

DIVINE GRACE દિવ્ય કૃપા

Divya Jivan Sangh

Sivananda Ashram, Sivananda Marg, Jodhpur Tekari, Ahmedabad 380015.

Tel.: 079-26861234 • **TeleFax:** 079-26862345

Email : sivanandad1@sanchamnet.in

sivananda_ashram@yahoo.com

sivanandaashram@gmail.com

Website: <http://www.divyajivan.org>

Edition : First • **Price :** Rs. 25/- • **Quantity :** 5000 Copies



THE DIVINE LIFE SOCIETY, AHMEDABAD

દિવ્ય જીવન સંઘ, અમદાવાદ

ૐ

પ્રાસ્તાવિક

દિલ્હીમાં હતા એક મહાપુરુષ!

ઔલિયા નિઝામુદ્દીન!

તેની પાસે કોઈ એક અભ્યાગત રોજ આવતો, “મેરી બેટીકા નિકાહ હૈ! મૈલા મદદ કરો!” આ બંદગી મહિનાઓ સુધી ચાલી. પરંતુ મૈલા તે વળી શું આપે? એક ફકીર! એક દિવસ અભ્યાગત ખળભળ્યો; મૈલાના પગ પકડીને તેમને હચમચાવી નાખ્યા.

અને મૈલાએ તેને કંઈક આપ્યું? શું આપે? મૈલા પાસે હોય તે જ આપી શકે? તેમની પાસે તેમની કહેવાય તે સમ્પત્તિ હતી, તેમનાં પોતાનાં ફાટેલાં પગરખાં! અભ્યાગતે પગરખાં લીધાં તો ખરાં પરંતુ દુઃખી દિલથી લઈને કરે પણ શું? રખાય પણ નહિ...ફેંકાય પણ નહિ. આ પગરખાંઓ માથાના ફાળિયામાં વીંટી પોતાને ગામને રસ્તે પડ્યો. રસ્તે ચાલતાં થાક્યો. એટલે ફાળિયે બાંધેલાં પગરખાંનું ઓશીકું કરીને સૂતો.

હવે બન્યું એવું કે તે જંગલની વાટે એક વણજાર નીકળી. વેપારી સોદાગર; ઊંટોની પોઠો. ચાળીસ ઊંટ. પોઠમાં હતા હીરા ને માણેક, મોતી ને નિલમ, જર-જવેરાત વગેરે...તેણે કહ્યું “રોકો! મને મારા મૈલાની ઉપસ્થિતિની અનુભૂતિ થઈ રહી છે.” પગરખાંઓની ગંધેગંધે તેણે વટેમાર્ગને શોધી કાઢ્યો.

પેલો યાચક કહે “મહિનાઓ વિત્યા આરજુ કરતાં; ત્યારે આ જૂતીઓ મળી...મૈ કયા કરું? તુમ્હે ચાહીએ? લો લેલો!” સોદાગરે સન્માન પૂર્વક તે પગરખાં હાથમાં લીધાં તેને આંખોએ અડકાડ્યાં; મ્હોંએ ચૂમ્યાં, પછી કહ્યું “આઓ!

ગીલા મત કરો. તુમતો મૈલાસે મદદ ચાહતે હો ના? તુમ્હારી બેટીકા નિકાહ કરોગે, વહ બેટી મૈલાકી હૈ, આઓ...” અને પેલા ચાળીસે ચાળીસ ઊંટોની પોઠની દોરી એના હાથમાં સોંપી દીધી.

હવે સૌદાગર પાદુકાઓને લઈને પ્રેમપૂર્વક મૈલા હજરત નિઝામુદ્દીન સાહેબને ત્યાં આવ્યો. જુહાર કરી. પાદુકાઓ તેમનાં શ્રી ચરણોમાં પધરાવી. ત્યારે મૈલાએ પૂછ્યું, “સૌદા કિતને મેં કિયા?” સૌદાગરે કહ્યું, “મૈલા! બહૂત કૂછ તો નહીં થા સીર્ફ ચાલીસ ઊંટ હી થે... કૂછ કીંમતી પથ્થરોંસે ભરે, બસ ઈતનાહી દે પાયા...” અને હજરત સાહેબ બોલ્યા “બંદે! તબ ભી સૌદા સસ્તે મેં હી પડા હૈ!!!”

આજે આપણને તો ગુરુકૃપા અમૃતનું ઝરણું મળ્યું છે. અમૃતધારા! તેમના સ્વહસ્તે લખેલ તેમની આર્ષવાણી “દિવ્ય કૃપા”!

આશરે ૧૪ વર્ષ પૂર્વે પૂજ્ય શ્રી ગુરુ ભગવાન શ્રીમત્ સ્વામી ચિદાનંદજી મહારાજે સ્વહસ્તે લખીને આ પવિત્ર વચનોનું ભાથું સ્વામી અધ્યાત્માનંદજીને બાંધી આપ્યું હતું. તેમાંથી માત્ર એક જ વચન દિવંગત સ્વાદિયા કાકાએ છાપીને “કાર્ડ”ના રૂપમાં વિતરણ કર્યું હતું. આ ખજાનો ફરી હાથ લાધ્યો. આજ તેને મુદ્રણ કરીને “દિવ્ય કૃપા” ના સ્વરૂપમાં આપ સૌની સાધનામાં સહાય અર્થે પથપ્રદર્શક થવા તેને પ્રસ્તુત કરવાનો હર્ષ છે.

આદરણીય ડૉ. મફતભાઈ જે. પટણી સાહેબના આપણે સૌ આભારી રહીશું કે તેઓશ્રીએ જહેમત કરીને આ સર્વે કૃપા કિરણોને અજવાળું દેખાડ્યું છે. મુદ્રક હરિઔં પ્રિન્ટરી અને દાતાઓ સૌનો આભાર. પાઠકો માત્ર વાંચે જ નહીં; વિચારે, વાગોળે. તે પ્રમાણે એક એક કદમ આગળ ચાલે અને દિવ્ય જીવનને પામે, ત્યાંજ સાર્થક થશે “દિવ્ય કૃપા”. હરિ: ઔં.

— દિવ્ય જીવન સંઘ

Om
Foreword

Once upon a time there lived a great saint in Delhi. His name was Hazrat Nizamuddin Saheb.

A poor man came to him everyday and pleaded "Please help me, O master, my daughter is getting married." But what could the saint give? He did not have anything of his own. But one day the poor man's words moved him. He wished to help the poor man. He gave away his old torn out shoes to the poor man as this was all that the Saint had with him.

The poor man took the gift of shoes reluctantly and went away. While he was on his way he saw a caravan passing by. As the caravan passed by the poor man, the owner of the caravan got off his camel. Looking around he started searching for something. Finally he saw the poor man with shoes in his hands. Guided by the holy smell of the shoes, he rushed to the poor man. The poor man was surprised. He thought the trader was crazy. "Take away these shoes if you like" he said. The trader was overwhelmed. He offered his caravan of forty camels loaded with precious stones in exchange of the shoes!!

The poor man was amazed. He thought his daughter now can be married off lavishly.

The trader came to saint Hazrat Nizamuddin Saheb with the old shoes in his hands. Seeing him the saint inquired "How much did you pay to settle the deal?". The trader said "Not much, I had only forty camels loaded with precious stones to offer". "Not a bad deal indeed" said Maulla.

How fortunate we are that we have received the stream of "Gurukrupa" in the form of his writings! About 14 years back Sadgurudev Sri Swami Chidanandaji Maharaj had handed over this hand written script to Sri Swami Adhyatmanandaji. Late Sri Swadiaji of Baroda had printed a few lines from the above script as a card. We are glad that this valuable treasure is now being printed as "Divyakrupa". We are thankful to Dr. Mafatbhai Patani Saheb for preparing the manuscript; Printers Hari Om Printery also deserve appreciation for this work.

We hope the readers will not only glance upon this holy sermon, but will also meditate on the hidden treasure for the beautitude of the SELF!. May this stream of knowledge quench the thirst of spiritual seekers and bring a new hope of life divine to each one of them.

– Divya Jivan Sangh

ॐ
He is a true Bhakta or devotee of the Lord who
has love for all God's creatures, big or small
and lives to serve them all,
Swami Chidananda
ॐ

Om

He is a true Bhakta or devotee of the Lord who has love for all God's
creatures, big or small and lives to serve them all.

- Swami Chidananda

ॐ

ઈશ્વરે સર્જેલાં નાનાં મોટાં બધાં પ્રાણીઓ તરફ જેને પ્રેમ છે તે ભગવાનનો સાચો ભક્ત છે. તેનું જીવન
આ બધાંની સેવા માટે જ હોય છે.

- સ્વામી ચિદાનંદ

ॐ

Truthfulness, Purity of conduct and Character and harmlessness and compassion for all forms of life - these constitute the gateway to higher life and spiritual blessedness.

Chidananda
ॐ

Om

Truthfulness, Purity of conduct and Character and harmlessness and compassion for all forms of life - these constitute the gateway to higher life and spiritual blessedness.

- Chidananda

ॐ

સત્યપરાયણતા, વર્તન અને ચારિત્ર્યની પવિત્રતા અને જીવનનાં બધાં સ્વરૂપો તરફ નિરુપદ્રવતા અને દયા - આ બધાં ઉચ્ચતર જીવન અને આધ્યાત્મિક ધન્યતા માટેનાં પ્રવેશદ્વાર રહે છે.

- ચિદાનંદ

ॐ
The Divine Life ideal taught by worshipful Gurudev Sri Swami Sivanandaji is the only way to free yourself from the miseries created by modern materialism.

Swami Chidananda

Om

The Divine Life ideal taught by worshipful Gurudev Sri Swami Sivanandaji is the only way to free yourself from the miseries created by modern materialism.

- Swami Chidananda

ॐ

પૂજ્ય ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજીએ શીખવેલો દિવ્ય જીવનનો આદર્શ જ આધુનિક જડવાદે સર્જેલાં દુઃખોમાંથી તમારી જાતને મુક્ત કરવાનો એકમાત્ર માર્ગ છે.

- સ્વામી ચિદાનંદ

ॐ

The Essence of Spiritual life and Sadhana is to shine with sublime Virtue, to ever be in constant remembrance of God and do all actions worshipfully and offer them to God.

Swami Chidananda

Om

The Essence of Spiritual Life and Sadhana is to shine with sublime Virtue, to ever be in constant remembrance of God and do all actions worshipfully and offer them to God.

- Swami Chidananda

ॐ

આધ્યાત્મિક જીવન અને સાધનાનો સાર છે — ઉદાત્ત પવિત્રતાથી દીપી ઊઠવું, ઈશ્વરના સતત સ્મરણમાં રહેવું અને બધી જ પ્રવૃત્તિઓ ઈશ્વર તરફના પૂજ્યભાવથી કરી તેમને તેનું સમર્પણ કરવું.

- સ્વામી ચિદાનંદ

ॐ
If you really and truly want to attain God then treat everyone
with reverence and regard all things in this world as worthless
and Zero in value. Desire nothing and set your entire being on God. Thus.

Swami Chidananda

Om

If you really and truly want to attain God, then treat every one with reverence
and regard all things in this world as worthless and zero in value. Desire nothing
and set your entire being on God. Thus.

- Swami Chidananda

ॐ

જો તમારે ખરેખર અને સચ્ચાઈથી ઈશ્વરને પ્રાપ્ત કરવા હોય તો દરેકની સાથે આદરભાવ રાખો અને આ
દુનિયાની બધી વસ્તુઓને નકામી અને શૂન્ય મૂલ્યની ગણો. કશાની આકાંક્ષા ન રાખો અને તમારી સમગ્ર
જાતને ઈશ્વરને સોંપી દો. તો જ.

- સ્વામી ચિદાનંદ

ॐ
The heart of Yoga and Vedanta is to be found in
these four - Selfless Service, Devout Worship, Daily Meditation
and constant discrimination & Atma Chintan !

Swami Chidananda
ॐ

Om

The heart of Yoga and Vedanta is to be found in these four - Selfless Service,
Devout Worship, Daily Meditation and constant discrimination & Atma Chintan.

- Swami Chidananda

ॐ

યોગ અને વેદાંતનો આત્મા આ ચાર - નિષ્કામ સેવા, ભાવિક ઉપાસના, નિત્યનું ધ્યાન અને સતત
વિવેક અને આત્મચિંતન - માં રહેલો છે.

- સ્વામી ચિદાનંદ

Life itself the great Sadhana^ઐ of all Sadhanas. Understand
life and live it with this "bhav" spiritualise all your activity
and convert them into Yoga. This is the secret of Success in spiritual life.

Swami Chidananda
ॐ

Om

Life itself is the great Sadhana of all Sadhanas. Understand life and live it with this "bhav". Spiritualise all your activity and convert them into Yoga. This is the secret of Success in spiritual life.

- Swami Chidananda

ॐ

જીવન પોતે જ બધી સાધનાઓથી મહાન સાધના છે. જીવનને સમજો અને આ 'ભાવ' સાથે જીવો. તમારી બધી જ પ્રવૃત્તિઓનું આધ્યાત્મીકરણ કરો અને તેમને યોગ સાથે જોડો. આ આધ્યાત્મિક જીવનમાં સફળતા મેળવવા માટેનું રહસ્ય છે.

- સ્વામી ચિદાનંદ

ॐ
Beloved Friend, you have not come here to weep and wail
and die. Sorrow is not your goal. Your divine destiny is
to rise up from bondage and ascend into Bliss, Peace and
Divine Perfection!

Swami Chidananda

Om

Beloved friend, you have not come here to weep and wail and die. Sorrow is
not your Goal. you divine destiny is to rise up from bondage and ascend into Bliss,
Peace and Divine Perfection!

- Swami Chidananda

ॐ

વહાલા મિત્ર, તમે અહીં રડવા, વિલાપ કરવા અને મરી જવા માટે આવ્યા નથી. શોક એ તમારું લક્ષ્ય
નથી. તમારી દિવ્ય નિયતિ તો બંધનમાંથી મુક્ત થવાની અને પરમસુખ, શાંતિ અને દિવ્ય પૂર્ણતા તરફ
આરોહણ કરવાની છે !

- સ્વામી ચિદાનંદ

ॐ
Beloved Sadhak, thou art radiant spirit, Immortal
Atman! Be bold & fearless. Thou are the Child of God
therefore be divine. Rejoice in this wonderful Truth. Let
your life be divine.

Swami Chidananda

Om

Beloved Sadhak, thou art radiant spirit, Immortal Atman! be bold and fearless.
Thou are the Child of God, therefore be divine. Rejoice in this wonderful Truth.
Let your life be divine.

- Swami Chidananda

ॐ

વહાલા સાધક, તું ઉજ્જવળ જીવાત્મા અમર આત્મા છે ! બહાદુર અને નીડર બન. તું ઈશ્વરનું બાળક છે
માટે દિવ્ય બન. આ અદ્ભુત સત્ય માટે આનંદ પામ. તારું જીવન દિવ્ય બનો.

- સ્વામી ચિદાનંદ

ॐ

Moral rectitude & Ethical Character constitute the basis of religion & spiritual life. Without this foundation Yoga & Sadhana will be futile. Attain this first.

Chidananda

Om

Moral rectitude & Ethical Character constitute the basis of religion & spiritual life. Without this foundation Yoga & Sadhana will be futile. Attain this first.

- Chidananda

ॐ

પ્રમાણિકતા અને નૈતિક ચારિત્ર્ય, ધર્મ અને આધ્યાત્મિક જીવનનો પાયો નાખે છે. આ પાયા વગર યોગ અને સાધના વ્યર્થ બનશે. માટે પ્રથમ તેને પ્રાપ્ત કરો.

- ચિદાનંદ

ॐ

It is unwise & foolish to expect happiness through temporary & perishable objects of this world. They are all finite and imperfect. Real happiness can be found in God alone, the all-full.

Swami Chidananda
ॐ

Om

It is unwise & foolish to expect happiness through temporary & perishable objects of this world. They are all finite and imperfect. Real happiness can be found in God alone, the all-full.

- Swami Chidananda

ॐ

આ દુનિયાની અશાશ્વત અને ક્ષણભંગુર વસ્તુઓમાંથી સુખની આશા રાખવી એ ડહાપણ વગરનું અને મૂર્ખાઈ ભરેલું છે. તે બધી જ સીમિત અને અપૂર્ણ છે. સાચું સુખ ફક્ત પરિપૂર્ણ એવા ઈશ્વરમાંથી જ મળી શકે.

- સ્વામી ચિદાનંદ

ॐ

Be noble and magnanimous in your approach to life. Do not think, "What can I get from life? What can the World offer to me? Never harbour this idea. Think always, "What can I give?"

Swami Chidananda
ॐ

Om

Be noble and magnanimous in your approach to life. Do not think, "What can I get from life? what can the world offer to me? Never harbour this idea. Think always, "What can I give?"

- Swami Chidananda

ॐ

તમારા જીવનના અભિગમમાં ઉમદા અને ઉદાર રહો. "જીવનમાંથી મને શું મળવાનું છે?" દુનિયા મને શું આપી દેવાની છે?" એવું કદી ન વિચારો. આવા વિચારોને મનમાં પેસવા દેશો નહિ, "હું શું આપી શકું?" તેનો જ સદા વિચાર કરો.

સ્વામી ચિદાનંદ

ॐ

There is nothing impossible for you; all things are possible if only you have the deep earnestness, genuine sincerity and keen enthusiasm for attaining any goal you set for yourself. What your heart really longs for, that you get.

Swami Chidananda
ॐ

Om

There is nothing impossible for you; all things are possible if only you have the deep earnestness, genuine sincerity and keen enthusiasm for attaining any goal you set for yourself. What your heart really longs for, that you get.

- Swami Chidananda

ॐ

તમારે મારે કંઈ પણ અશક્ય નથી. કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જો તમારો ગંભીર મનોભાવ, અસર નેકી અને તીવ્ર ઉત્સાહ હશે તો બધું જ શક્ય છે. તમારા અંતઃકરણને જે ખરેખર જોઈએ છે તે તમને મળશે.

- સ્વામી ચિદાનંદ

ॐ

The second stage of life, the "gruhastha-ashrama" is a sacred state. It is a spiritual partnership between two individual souls. The wife and the husband should be mutual helpers to each other in the sublime task of evolving an Ideal life, fulfilling Dharma and seeking God.

Swami Chidananda
ॐ

Om

The second stage of life, the "Gruhastha-ashrama" is a sacred state. It is a spiritual partnership between two individual souls. The wife and the husband should be mutual helpers to each other in the sublime task of evolving an Ideal Life, fulfilling Dharma and seeking God.

- Swami Chidananda

ॐ

જીવનનું બીજું સોપાન ‘‘ગૃહસ્થાશ્રમ’’ એ પવિત્ર સોપાન છે તેમાં બે વિશિષ્ટ આત્મા વચ્ચેની આધ્યાત્મિક ભાગીદારી છે. ધર્મનો અમલ અને ઈશ્વરની પ્રાપ્તિનાં ઉદાત્ત કર્તવ્ય બજાવવા માટે જરૂરી આદર્શ જીવનનો વિકાસ કરવા માટે પત્ની તથા પતિએ એકબીજાનાં પરસ્પર સહાયક બનવાં જોઈએ.

- સ્વામી ચિદાનંદ

ॐ

O my beloved friend! Remember DEATH daily and fail not to fulfill your duties in life. Do not postpone your spiritual life and your Sadhana. Remember the Saints and draw inspiration from their Ideal Lives.

Swami Chidananda
ॐ

Om

O my beloved friend! Remember 'DEATH' daily and fail not to fulfill your duties in life. Do not postpone your spiritual life and your Sadhana. Remember the Saints and draw inspiration from their Ideal Lives.

- Swami Chidananda

ॐ

હે મારા વહાલા મિત્ર ! મૃત્યુનું દરરોજ સ્મરણ કર અને તારા જીવનની ફરજ બજાવવામાં પાછો પડીશ નહીં. તારા આધ્યાત્મિક જીવનને અને સાધનાને મુલતવી રાખીશ નહિ. સંતોનું સ્મરણ કર અને તેમનાં આદર્શ જીવનમાંથી પ્રેરણા મેળવ.

- સ્વામી ચિદાનંદ

ॐ

Dear Brother, to whatever religion you belong, read the scripture of your religion. Study your holy books with an unbiased and open heart. Note the universal truths you find therein. No person can be true to his or her religion unless you study your scripture. *Swami Chidananda*

Om

Dear Brother, to whatever religion you belong, read the scripture of your religion. Study your holy books with an unbiased and open heart. Note the universal truths you find therein. No person can be true to his or her religion unless you study your scripture.

- Swami Chidananda

ॐ

વહાલા ભાઈ, તમે જે કોઈ ધર્મ પાળતા હો, તમારા ધર્મના પવિત્ર ધાર્મિક ગ્રંથોનો પૂર્વગ્રહ વગર ખુલ્લા હૃદયથી અભ્યાસ કરો. તેમાં મળી આવતાં વૈશ્વિક સત્યોની નોંધ કરો. કોઈ પણ વ્યક્તિ તેના ધર્મનો અભ્યાસ ન કરે ત્યાં સુધી પોતાના ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન બની શકે નહિ.

- સ્વામી ચિદાનંદ

ॐ
 There is ONLY ONE GOD, only one Universal spirit,
 one Supreme Cosmic Being. Call Him by any name
 you know - Brahman, TAO, Ahura Mazda, YAHVEH,
 Father in Heaven, Allah, Ek Omkar or Bhagawan,
 but all the same HE IS ONE ONLY. And in Him we are all one !
 Swami Chidananda

Om

There is ONLY OF ONE GOD, only one Universal spirit, one supreme Cosmic Being. Call him by any name you know - Brahman, Tao, Ahura Mazda, Yahveh, Father in Heaven, Allah, Ek Omkar or Bhagwan, but all the same. He is ONE ONLY. And in him we are all one !

- Swami Chidananda

ॐ

ફક્ત એક જ ઈશ્વર છે. એક જ વૈશ્વિક આત્મા છે. એક જ પરમ બ્રહ્મ છે. તમે તેને ગમે તે નામે —
 બ્રહ્મ, તાઓ, અહુરમઝ્દા, યાહ્વા, સ્વર્ગના પિતા, અલ્લાહ, એક ઓમકાર કે ભગવાન — બોલાવો પણ બધામાં
 તે એક જ છે અને તેનામાં આપણે બધા પણ એક છીએ.

- સ્વામી ચિદાનંદ

ॐ

Beloved Friend, if you really and truly believe that God exists and He is an Omniscient Being, All Pervading and The Ever-present Witness of all your thoughts and your actions, then demonstrate your living belief by your actual life. Live a noble, pure and holy life worthy of His Presence.

Om

Swami Chidananda
ॐ

Beloved Friend, if you really and truly believe that GOD exists and He is an Omniscient Being, All Pervading and the Ever – present witness of all your thoughts and your actions, then demonstrate your living belief by your actual life. Live a noble, pure and holy life worthy of His Presence.

- Swami Chidananda

ॐ

વહાલા મિત્રો ! જો તમે ખરેખર અને સચ્ચાઈથી એમ માનતા હો કે ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે અને તે સર્વજ્ઞ છે, સર્વવ્યાપક છે અને તમારા બધા વિચારો અને કાર્યોનો સદા હાજર સાક્ષી છે, તો તમારા વાસ્તવિક જીવન દ્વારા તમારી આ ચેતનયુક્ત માન્યતાને વ્યક્ત કરો. તેની હાજરીને અનુરૂપ ઉમદા, પવિત્ર અને પાપરહિત જીવન જીવો.

- સ્વામી ચિદાનંદ

ॐ

If you say that you believe in God and that you are a devotee of God and at the same time you act and behave as if He did not exist, then you are doing the greatest dis-service to your nation and greatest dis-service to your own religion ! Stop this from this very moment.

Om

Swami Chidananda
ॐ

If you say that you believe in God and that you are a devotee of God and at the same time you act and behave as if He did not exist, then you are doing the greatest dis-service to your nation and greatest dis-service to your own religion ! Stop this from this very moment.

- Swami Chidananda

ॐ

જો તમે એમ કહેતા હો કે તમે ઈશ્વરમા માનો છો તથા તમે ઈશ્વરના ભક્ત છો, પરંતુ સાથે સાથે તમે એવી પ્રવૃત્તિ અને એવું વર્તન કરો છો કે જાણે તે છે જ નહિ તો તમે તમારા રાષ્ટ્રની અને તમારા પોતાના ધર્મની પણ ખૂબ મોટી કુસેવા કરી રહ્યા છો ! આ જ કાણે તેને અટકાવી દો.

- સ્વામી ચિદાનંદ

ॐ

The home of a householder and family man, is the royal gateway to God - Realization if all the members of the family regard the home as a sacred place and Centre for their spiritual life and evolution ! Make your home the place of your Sadhane & attain Liberation .
Swami Chidananda

Om

The home of a householder and family man, is the royal gateway to God - Realization if all the members of the family regard the home as a sacred place and centre for their spiritual life and evolution ! make your home the place of your Sadhana & attain liberation.
- Swami Chidananda

ॐ

જો કુટુંબના બધા સભ્યો પોતાના ઘરને એક પવિત્ર સ્થાન અને પોતાના આધ્યાત્મિક જીવન અને તેના વિકાસ માટેનું કેન્દ્ર માનતા હોય તો ગૃહસ્થ અને કુટુંબના સભ્યોનું ઘર ઈશ્વર પોતાના સાક્ષાત્કારના ભવ્ય દ્વાર સમાન બની જાય છે ! તમારા ઘરને તમારી સાધનાનું સ્થાન બનાવો અને મુક્તિ મેળવો. - સ્વામી ચિદાનંદ

ॐ

*Ever live in the awareness of God's immediate Presence!
Then your life will become a divine life by the very fact
of this awareness. Being thus aware of His proximity and
His constant Presence your life will be uplifted and elevated
to a higher plane of purity & nobility.*

Swami Chidananda
ॐ

Om

Ever live in the awareness of God's immediate Presence! Then your life will become a divine life by the very fact of this awareness. Being thus aware of his proximity and his constant Presence, your life will be uplifted and elevated to a higher place of purity & nobility.

- Swami Chidananda

ॐ

ઈશ્વરની પ્રત્યક્ષ હાજરીની સભાનતામાં સદા જીવો! તો આ સભાનતાની વસ્તુસ્થિતિ જ તમારા જીવનને દિવ્ય બનાવશે. આથી તેના સાન્નિધ્ય અને તેની સતત હાજરીની સભાનતાથી તમારું જીવન પવિત્રતા અને ઉમદાપણના ઉચ્ચતર સ્તરે પહોંચી ઉન્નત અને ઉદાત્ત બનશે.

- સ્વામી ચિદાનંદ

ॐ
The message of Gurudev Swami Sivanandaji for the
modern man is the message of Divine Life. This contains the
Central Teaching of the Upanishads and the message of the Bhagawat Gita,
namely, the Divine & Immortal nature of your true Self and the way of attaining
the Experience of this true SELF! You are Divine, let your life be divine!

Swami Chidananda
ॐ

Om

The message of Gurudev Swami Sivanandaji for the modern man is the
message of Divine Life. This contains the central teaching of the Upanishads and
the message of the Bhagawat Gita, namely, the Divine & Immortal nature of your
true self and the way of attaining the Experience of this true SELF! You are
Divine, let your life be divine!

- Swami Chidananda

ॐ

ગુરુદેવ સ્વામી શિવાનંદજીનો આધુનિક માનવને આપેલ સંદેશ દિવ્ય જીવનનો સંદેશ છે. આ સંદેશમાં
ઉપનિષદના મુખ્ય ઉપદેશો અને ભગવદ્ ગીતાનો સંદેશ છે. ગીતાના સંદેશમાં તમારા વાસ્તવિક આત્માની
દિવ્ય અને અમર પ્રકૃતિ અને તેનો અનુભવ મેળવવા માટેના માર્ગનો સમાવેશ થાય છે! તમે દિવ્ય છો,
તમારા જીવનને પણ દિવ્ય બનાવો!

- સ્વામી ચિદાનંદ

ॐ

An Indian citizen cannot be a true Indian citizen unless and until the twin Ideals of "Paropakara" and "Bhagwat-Sakshatkara" become enshrined in his heart. These two ideals constitute the very essence of our Culture and view of life.

Swami Chidananda

Om

An Indian citizen cannot be a true Indian citizen unless and until the twin ideals of "Paropakara" and "Bhagwat-Sakshatkara" become enshrined in his heart. These two ideals constitute the very essence of our culture and view of life.

- Swami Chidananda

ॐ

જ્યાં સુધી 'પરોપકાર' અને 'ભગવત-સાક્ષાત્કાર' ના જોડિયા આદર્શો પોતાના હૃદયમાં પ્રતિસ્થાપિત ન થાય ત્યાં સુધી કોઈપણ ભારતીય નાગરિક સાચો ભારતીય નાગરિક બની શકે નહિ. આ બન્ને આદર્શો આપણા સંસ્કાર અને જીવનદૃષ્ટિનું પરમસત્ત્વ છે.

- સ્વામી ચિદાનંદ

ॐ
30

When the sun rises and a New Day dawns, let this mean
to you a new and golden day in your life given to you to fill
it with selflessness service, devotion & worship, Concentration & meditation
and quest after the Eternal by constant discrimination & Reflection !

Swami Chidananda
ॐ

Om

When then sun rises and a New Day dawns, let this mean to you a new and
golden day in your life given to you to fill it with selflessness service, devotion &
worship. concentration & meditation and quest after the eternal by constant
discrimination & reflection !

- Swami Chidananda

ॐ

જ્યારે સૂર્ય ઊગે છે અને નવો દિવસ શરૂ થાય છે ત્યારે માનીએ કે તમને તમારા જીવનમાં નૂતન અને
સોનેરી દિવસ આપવામાં આવ્યો છે, જેને તમારે નિષ્કામ સેવા, ભક્તિ અને પૂજા, એકાગ્રતા અને ધ્યાન
તથા સતત વિવેક અને ચિંતનથી ભરી દેવાનો છે.

- સ્વામી ચિદાનંદ

ॐ

Eradicate vice & cultivate virtue, Constantly remember God even in the midst of your daily duties & work. Do all your activities in the spirit of worship and dedicate all these activities at the feet of God. This is an effective Sadhana for God Realization.

Swami Chidananda
ॐ

Om

Eradicate vice & cultivate virtue. Constantly remember God even in the midst of your daily duties & work. Do all your activities in the spirit of worship and dedicate all these activities at the feet of God. this is an effective Sadhana for God Realization.

- Swami Chidananda

ॐ

દુર્ગુણને નિર્મૂળ કરો અને સદ્ગુણનો વિકાસ કરો. તમારી દૈનિક ફરજો અને પ્રવૃત્તિઓ દરમિયાન ઈશ્વરનું સતત સ્મરણ કરો. તમારી બધી જ પ્રવૃત્તિઓ પૂજના ભાવ સાથે કરો અને આ બધી પ્રવૃત્તિઓને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરો. ઈશ્વર-સાક્ષાત્કાર માટેની આ એક અસરકારક સાધના છે.

- સ્વામી ચિદાનંદ

ॐ

Egoism and cunning cleverness are obstacles to success in Sadhana.

Untruth is the greatest impurity. Anger is a great sin for it leads to many other wrong actions. Carnal passion & gross sensuality are diseases afflicting our spiritual life. Avoid these with care & become blessed.

Swami Chidananda

Om

Egoism and Cunning cleverness are obstacles to success in Sadhana. Untruth is the greatest impurity. Anger is a great sin for it leads to many other wrong actions. Carnal passion & gross sensuality are diseases afflicting our spiritual life. Avoid these with care and become blessed.

- Swami Chidananda

ॐ

સાધનામાં સફળતાની પ્રાપ્તિમાં અહંકાર અને લુચ્ચી હોશિયારી મોટા અવરોધ છે. અસત્ય એ સૌથી મોટી અશુદ્ધિ છે. ક્રોધ એ મોટું પાપ છે, કારણ કે તે માનવને ઘણાં બીજા અનિષ્ટો તરફ દોરે છે. વિષયોના મનોવિકાર અને હલકી વિષયલંપટતા આપણા આધ્યાત્મિક જીવનને દુઃખ આપતા રોગો છે. આ બધાથી દૂર રહો અને પરમાનંદ પામો.

- સ્વામી ચિદાનંદ

ॐ

The practice of the Divine Name burns up all impurity of the heart and mind and destroys all sin and evil. Divine Name is a Power that can destroy your ignorance and bondage and for ever liberate you from death and rebirth. Therefore be engaged in the NAME.

Swami Chidananda
३६

Om

The practice of the Divine Name burns up all impurity of the heart and mind and destroys all sin and evil. Divine name is a power that can destroy your ignorance and bondage and for ever liberate you from death and rebirth. Therefore be engaged in the NAME.

- Swami Chidananda

ॐ

દિવ્ય નામનું રટણ હૃદયની અને મનની બધી અશુદ્ધિઓને બાળી નાખે છે અને બધાં પાપ અને અનિષ્ટોનો નાશ કરે છે. દિવ્ય નામ એ એવી શક્તિ છે જે તમારા અજ્ઞાન અને બંધનનો નાશ કરે છે અને તમને હંમેશ માટે જન્મ અને મરણના ફેરામાંથી મુક્તિ આપે છે. માટે નામમાં રત રહો.

- સ્વામી ચિદાનંદ

ॐ

Worshipful Gurudev Swami Sivanandaji Maharaj put
the entire teachings of the holy scriptures and of all
His Saints into his prayer called the, "UNIVERSAL - prayer."
Try to live in the spirit of this Prayer. You will be most blessed.
Swami Chidananda

Om

Worshipful Gurudev Swami Sivanandaji Maharaj put the entire teachings of the
holy scriptures and of all His Saints into his prayer called the, "Universal" - prayer.
Try to live in the spirit of this Prayer. You will be most blessed.

- Swami Chidananda

ॐ

પૂજ્ય ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજે ધાર્મિક ગ્રંથો અને બધા સંતોના સમગ્ર ઉપદેશોને તેમની
'વિશ્વ - પ્રાર્થના' માં સમાવ્યા છે. આ પ્રાર્થનાના ભાવમાં રહેવાનો પ્રયત્ન કરો. તમે પરમાનંદ પામશો.

- સ્વામી ચિદાનંદ

ॐ

Radiant Atman! You have come into this world not to live and then die and be forgotten. You have come here to attain Immortality. You have not come merely to weep and wail & suffer. But, you have come to utilise life to attain Supreme Bliss & Divine Peace through God Experience!

Om

Swami Chidananda

Radiant Atman! You have come into this world not to live and then die and be forgotten. You have come here to attain Immortality, you have not come merely to weep and wail & suffer. But, you have come to utilise life to attain Supreme Bliss & Divine Peace through God Experience.

- Swami Chidananda

ॐ

ઉજ્જવળ આત્મા ! તમે આ દુનિયામાં રહેવા અને પછી મૃત્યુ પામી ભૂલી જવા માટે આવ્યા નથી. તમે અહીં અમરતા પ્રાપ્ત કરવા આવ્યા છો. તમે ફક્ત રડવા, વિલાપ કરવા કે સહન કરવા જ આવ્યા નથી. પણ, તમે તમારા જીવનનો ઉપયોગ ઈશ્વર-અનુભવ દ્વારા આનંદ અને દિવ્ય શાંતિ પામવા માટે આવ્યા છો.

- સ્વામી ચિદાનંદ

PRAYER

Lord, make me an instrument of Thy Peace,
Where there is hatred, let me sow love;
Where there is injury, let me sow pardon;
Where there is doubt, let me sow faith;
Where there is despair, let me sow hope;
Where there is discord, let me sow unity;
Where there is darkness, let me sow light and
Where there is sadness, let me sow joy.

O Divine Master,
Grant that I may not seek so much
To be consoled as to console;
To be understood as to understand;
To be loved as to love;
For it is in giving that we receive
It is in pardoning that we are pardoned;
And it is in dying to the little self
That we are born to eternal life.

– St. Francis of Assisi

THE UNIVERSAL PRAYER

O adorable Lord of Mercy and Love !
Salutations and prostrations unto Thee.

Thou art Satchidananda.

Thou art Omnipresent, Omnipotent and omniscient

Thou art the Indweller of all beings.

Grants us an understanding heart,

Equal vision, balanced mind,

Faith, devotion and wisdom.

Grant us inner spiritual strength

To resist temptations and to control the mind.

Free us from egoism, lust, greed,

Hatred, anger and jealousy.

Fill our heart with divine virtues.

Let us behold Thee in all these names and forms.

Let us serve Thee in all these names and forms.

Let us ever remember Thee.

Let us ever sing Thy glories.

Let Thy Name be ever on our lips.

Let us abide in Thee for ever and ever.

- Swami Sivananda

THE UNIVERSAL PRAYER

O adorable Lord of Mercy and Love !
Salutations and prostrations unto Thee.

Thou art Satchidananda.

Thou art Omnipresent, Omnipotent and omniscient

Thou art the Indweller of all beings.

Grants us an understanding heart,

Equal vision, balanced mind,

Faith, devotion and wisdom.

Grant us inner spiritual strength

To resist temptations and to control the mind.

Free us from egoism, lust, greed,

Hatred, anger and jealousy.

Fill our heart with divine virtues.

Let us behold Thee in all these names and forms.

Let us serve Thee in all these names and forms.

Let us ever remember Thee.

Let us ever sing Thy glories.

Let Thy Name be ever on our lips.

Let us abide in Thee for ever and ever.

- Swami Sivananda